

## વ્યારા કોલેજમાં બી.એ./બી.કોમ. સેમ.૧-૩-૫ તથા એમ.એ. સેમ.૧-૩માં પ્રવેશ લેનાર તમામ વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના અને માર્ગદર્શન

1. BA/BCOM સેમેસ્ટર-૧/૩/૫ અને M.A. સેમ.-૧ -૩ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઓનલાઇન (online) પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી છે.
2. આપના પ્રવેશ અંગેનો આખરી નિર્ણય કોલેજનો રહેશે. જે તમામ વિદ્યાર્થીને બંધનકર્તા રહેશે.
3. આપે ફી ભરીને યાદીમાં દર્શાવેલ વિષય મુજબ પ્રવેશ મેળવવાનો છે. આપે ફી ભરી ને પ્રવેશ મેળવ્યા હશે તો પણ આપનો કાયમી પ્રવેશ તમારા ઓરીજનલ (અસલ) પ્રમાણપત્રો વેરીફાય કર્યા પછી જ તમારો પ્રવેશ મંજૂર કે ના મંજૂર થશે.
4. નજીકના દિવસોમાં એફ.વાય.બી.એ./બી.કોમ. સેમ.-૧ ના ઓનલાઇન વર્ગો શરૂ થશે. જેની જાણ કોલેજ દ્વારા આપે રજીસ્ટર કરેલ (ફોર્મમાં લખેલ) મોબાઇલ નંબર ઉપર SMS દ્વારા જાણ કરવામાં આવશે. બી.એ./બી.કોમ. સેમ-૩-૫ અને એમ.એ. સેમ-૩ ના ઓનલાઇન વર્ગો ચાલી રહ્યા છે.

**દરેક વિદ્યાર્થીએ રોજ કોલેજ વેબસાઇટ [vyaracollege.in](http://vyaracollege.in) જોતાં રહેવું.**

5. નજીકના દિવસોમાં શિષ્યવૃત્તિના ફોર્મ ઓનલાઇન ભરાશે. શિષ્યવૃત્તિ મેળવવાપાત્ર વિદ્યાર્થીઓએ કોલેજમાં ફી ભરી પ્રવેશ લીધો હશે તો જ તે શિષ્યવૃત્તિનું ફોર્મ ભરી શકશે. આ શિષ્યવૃત્તિનું ફોર્મ ભરશો ત્યારે આપને આ ફી ભર્યા અંગેના મેસેજ ની જરૂર પડશે અને તે જરૂરી છે. ફી રસીદ કોલેજમાંથી જનરેટ કરી આપને આપવામાં આવશે. નજીકના દિવસોમાં ઓનલાઇન શિષ્યવૃત્તિના ફોર્મ ભરશે તે માટે પણ કોલેજની વેબસાઇટ જોતાં રહેવું.

**જ્યાં સુધી કોલેજ ઉપર બોલાવવામાં ના આવે ત્યાં સુધી કોલેજ પર જવું નહીં. જરૂર જણાય તો કોલેજના સંપર્ક નંબર 78747000406 તથા 9998362649 અથવા 02626220185 ઉપર ઓફિસ સમય દરમિયાન સંપર્ક કરવો.**

6. એફ.વાય. બી.એ. સેમેસ્ટર-૧માં જે વિદ્યાર્થીઓને જુદા જુદા વિષયમાં આપને ટેલિફોનિક સંપર્ક કરીને જે તે મુખ્ય વિષયમાં પ્રવેશ આપવામાં આવેલ છે, તે પ્રમાણે જ વિષય પ્રવેશ માન્ય રહેશે.

## **ફી ભરવા અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન**

1. વિદ્યાર્થીએ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરવાથી ઓનલાઇન ફી ભરવાનું ફોર્મ ખુલશે જેના દ્વારા ફી ભરી શકશે. આ લિંક વેબસાઇટ પેજ ઉપર પણ મુકેલ છે.  
**<https://www.onlinesbi.com/sbicollect/icollecthome.htm?corpID=2247556>**
2. ફોર્મ ખુલશે એટલે તેમાં આપે અગાઉ રૂ. 150 ઓનલાઇન ફી ભરી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ત્યારે આપને 10 આંકડાનો રજીસ્ટ્રેશન આઈ.ડી. મળ્યો હતો. આ નંબર માંગેલ જગ્યાએ ટાઇપ કરવો એટલે તરત જ તેમાં આપની કેટલીક જરૂરી વિગતો દેખાશે. (ઉપર આપેલ યાદીમાં લાલ રંગમાં આપનો રજીસ્ટ્રેશન આઈ.ડી. છે )
3. ત્યારબાદ જે મોબાઇલ નંબર ફોર્મ ભરતી વખતે જે ચાલુ હોય તે મોબાઇલ નંબર માગેલી જગ્યાએ ટાઇપ કરવો.

4. આ ઉપરાંત આપનું ઇ-મેલ પણ માંગેલી જગ્યાએ ટાઈપ કરવો.
5. ફોર્મ બરાબર ભરાય પછી સબમીટ બટન ઉપર ક્લિક કરવું.
6. ઓનલાઇન ફી ભરવા માટે બેંક જવાની જરૂર નથી. આપના ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ, UPI કે અન્ય કાર્ડનો ઉપયોગ કરી ફી ભરી શકશે. પરંતુ આપે એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે ઉપરોક્ત ક્રેડીટ કે ડેબીટ કાર્ડ જે મોબાઈલ જોડે નંબર સાથે લિંક કરાવેલ હોય તે મોબાઈલ નંબર પણ આપની પાસે રાખવો પડશે. કારણ કે OTP આ બેંક જોડે લિંક કરેલ મોબાઈલ નંબર ઉપર જ આવશે. એન્ટર થી OTP નંબર આપું લખેલું આવશે ત્યાં તમારે આ OTP નંબર લખવાનો રહેશે. આપની પાસે ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ, UPI કે અન્ય કાર્ડ નહીં હોય તો આપ આપના સગાંવહાલાં કે પરિચિત વ્યક્તિના કાર્ડનો ઉપયોગ કરી ફી ભરી શકશો.
7. સૂચના નંબર-૬ માં દર્શાવ્યા મુજબ સબમીટ બટન ક્લિક કરવાથી ફોર્મ માં માંગેલી જગ્યાએ ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ, UPI કે અન્ય કાર્ડની માંગ્યા મુજબની વિગતો દર્શાવી શકાશે.
8. આમ કરવાથી OTP આવશે જે ફોર્મમાં માંગેલી જગ્યાએ તમારા મોબાઈલ પર મળેલ OTP ટાઈપ કરવાનો રહેશે.
9. અને ત્યારબાદ ok બટન ઉપર ક્લિક કરવાથી આપની ઓનલાઇન ફી કોલેજના ખાતામાં જમા થશે.
10. સૂચના નંબર 4 મુજબ આપનો હાલમાં કાર્યરત મોબાઈલ નંબર જે આપે આ ઓનલાઇન ફી ભરવા માટે દર્શાવેલ છે તેના ઉપર પૈસા ભરાયા છે તેનો મેસેજ આવશે. આ મેસેજ સાચવી રાખવો.
11. જો આપને રજીસ્ટ્રેશન આઈ. ડી. ન મળે તો આ સાથે ઉપર આપેલ યાદીમાંથી તે મેળવી શકાશે. આપને મુશ્કેલી પડે તો કોલેજના મો.નં. 78747000406 તથા 9998362649 અથવા 02626220185 ઉપર ઓફીસ સમય દરમિયાન સંપર્ક કરી શકાશે.
12. સર્વે વિદ્યાર્થી દીકરા-દીકરીઓને શુભકામના.